

RAN-2101000602010001

M. A. Economics (External) (Sem.- Part II) Examination March - 2026

Economics of Growth and Development (Paper - VI)

Time: 3 Hours]

[Total Marks: 100

સૂચના : / Instructions (1) ઉપરોક્ત દર્શાવેલ વિગતો ઉત્તરવહી પર અવશ્ય લખવી. Fill up strictly the above details on your answer book (2) જમણી બાજુના અંક પ્રશ્નના પુરા ગુણ દર્શાવે છે. The marks on the right side indicate the full marks of the question.	Seat No.: <table border="1"> <tr> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> <td> </td> </tr> </table> Student's Signature						

- પ્ર. 1. હેરોડ-ડોમર મોડેલનું તુલનાત્મક વિશ્લેષણ કરી મર્યાદાઓની ચર્ચા કરો. 20
અથવા
- પ્ર. 1. આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા આપી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત સમજાવો. 20
- પ્ર. 2. આર્થિક વૃદ્ધિના સિદ્ધાંતમાં રિકાર્ડોએ આપેલા જ્ઞાણની ચર્ચા કરી સિદ્ધાંતની મર્યાદા ચર્ચો 20
અથવા
- પ્ર. 2.(અ) કાર્લ માર્ક્સના સિદ્ધાંતની મર્યાદા ચર્ચો. 10
(બ) અધિશેષ મુલ્યનો ખ્યાલ. 10
- પ્ર. 3. આર્થિક વિકાસના માપદંડ તરીકે, માનવ ગરીબીઆંક, જીવનની ભૌતિક ગુણવત્તા આંક અને મહિલા વિકાસઆંકની સમજૂતી આપો. 20
અથવા
- પ્ર. 3. લેબેન્સસ્ટાઈનના વસ્તી સિદ્ધાંતની ચર્ચા કરો. 20
- પ્ર. 4. “અલ્પવિકસિત દેશોમાં અમર્યાદિત શ્રમના પુરવઠા દ્વારા મૂડીસર્જન શક્ય અને નફાકારક છે”
- આ વિધાનનું ટીકાત્મક પરીક્ષણ કરો. 20
અથવા
- પ્ર. 4. નિર્ણાયક લઘુત્તમ પ્રયાસ એટલે શું? અલ્પવિકસિત દેશોના સંદર્ભમાં આ ખ્યાલ સમજાવો. 20
- પ્ર. 5. વિકાસશીલ રાષ્ટ્રોમાં આર્થિક નીતિના સાધન તરીકે નાણાકીય નીતિની ભૂમિકા સમજાવો. 20
અથવા
- પ્ર. 5.(અ) ખર્ચ લાભ વિશ્લેષણ. 10
(બ) બહુરાષ્ટ્રીય કંપનીઓ. 10

ENGLISH VERSION

- Q. 1.** Comparatively analyze the Herod-Domer model and discuss its limitations. **20**
- OR**
- Q. 1.** Define economic growth and explain the difference between economic development and economic growth. **20**
- Q. 2.** Discuss the contribution of Ricardo in the theory of economic growth and discuss the limitations of the theory. **20**
- OR**
- Q. 2. (a)** Discuss the limitations of Karl Marx's theory. **10**
(b) The concept of surplus value. **10**
- Q. 3.** Explain the human poverty index, physical quality of life index and women's development index as measures of economic development. **20**
- OR**
- Q. 3.** Discuss Lebenstein's population theory. **20**
- Q. 4.** Critically examine the statement that capital formation is possible and profitable in underdeveloped countries through unlimited supply of labour. **20**
- OR**
- Q. 4.** What is critical minimum effort? Explain this concept in the context of underdeveloped countries. **20**
- Q. 5.** Explain the role of monetary policy as an instrument of economic policy in developing countries. **20**
- OR**
- Q. 5. (a)** Cost benefit analysis **10**
(b) Multinational companies **10**
-